

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રમ્પટનના ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને સતત ત્રીજા વર્ષે #1 ક્રમાંકન (રેંકિંગ) મળ્યું

બ્રમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 15, 2022) – ગઈકાલે, બિઝનેસ ફેસિલિટીસ મેગેઝિનના 18 માં વાર્ષિક મેટ્રો રેંકિંગ્સ રિપોર્ટમાં ફૂડ પ્રોસેસિંગ લીડર્સ શ્રેણીમાં પ્રથમ સ્થાનના ક્રમાંકન સાથે સીટી ઓફ બ્રમ્પટનને ટોચનું સન્માન મળ્યું. આ સતત ત્રીજા વર્ષે સીટીને આ ક્રમાંકન સાથે ઓળખ મળી છે.

બ્રમ્પટનને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે કર્મચારીઓની હારમાળા વિસ્તારવા વર્ષ 2021 ની પાનાખર (ફોલ) ઋતુમાં પાઈલોટ પ્રોગ્રામ શરૂ કરવા ટોચની ઓળખ મળી. આ ક્રમાંકનમાં ફાળો આપનારા અન્ય પરિબળો છે, રોજગાર, વિસ્તરણ અને ઉદ્યોગ માટેના કાર્યક્રમો. વર્ષ 2021 નાં ક્રમાંકનોનો આખો અહેવાલ અહીં જોઈ શકાય છે, www.businessfacilities.com.

ઓન્ટેરિયોના ફૂડ ક્લસ્ટરના (ખાદ્યપદાર્થોના ગુરુછાના) ભાગ તરીકે, ઉત્તર અમેરિકામાં સૌથી વિશાળ એગ્રી-ફૂડ સેક્ટર્સ પૈકી એક, બ્રમ્પટન ખોરાક અને પીણાનું સમૃદ્ધ ક્ષેત્ર ધરાવે છે જેને ઉદ્યોગ-આગેવાન ટેકનોલોજી, ટોચના ગુણવત્તાના ઉત્પાદો, અને વિપુલ ખેતીલક્ષી પરંપરાનો ટેકો છે. બ્રમ્પટનનું ખોરાક અને પીણાનું ક્ષેત્ર વન-સ્ટોપ શોપ છે જે ખોરાક પરખવો, પ્રક્રિયાકરણ અને પેકેજિંગ સગવડો તેમજ પરિવહન, પેકેજિંગ ડિઝાઈન, સાધનો અને રેક્રીજરેશન સંગ્રહ સાથે સંપૂર્ણ, બધું શહેરની અંદર સ્થિત છે.

બ્રમ્પટનના ખોરાક અને પીણા ક્ષેત્રો કેનેડિયન જીડીપીમાં વાર્ષિક \$1.3 બિલિયનનો ફાળો આપે છે. લગભગ 300 કંપનીઓ 8,500 લોકોની નિયુક્તિ ખોરાક અને પીણા ઉત્પાદન, પ્રક્રિયાકરણ અને સહાયક ઉદ્યોગોમાં કરે છે.

બ્રમ્પટનમાં ખોરાક અને પીણામાં ટોચના નિયોક્તાઓમાં (એમ્પ્લોયર્સમાં) Loblaws (લોબ્લોઝ), Maple Lodge (મેપલ લોજ) અને Itaipasta (ઈટાલપાસ્તા)નાં મુખ્યાલયોનો (હેડક્વાર્ટર્સનો) સમાવેશ થાય છે. વધુમાં, મહત્વના નિયોક્તાઓ જેમ કે Coca-Cola Bottling (કોકા-કોલા બોટલિંગ) અને Give and Go Prepared Foods (ગીવ એન્ડ ગો પ્રિપેર્ડ ફૂડ્સ) બ્રમ્પટનમાં સગવડો ધરાવે છે. આ બંધી કંપનીઓ બ્રમ્પટનમાં વ્યૂહાત્મક રીતે પોતાની સ્થિતિ પોતાની જાતે બનાવીને શહેરની પ્રતિભા, માળખાગત સગવડો અને બજારની પહોંચનો લાભ લે છે.

તાજેતરમાં, Toppits Food Ltd. (ટોપિટ્સ ફૂડ્સ લિમિટેડ) ખોરાક ઉત્પાદન ક્ષમતાઓના વિસ્તરણની અને પોતાની નવી બ્રમ્પટન સગવડમાં નવા સીફૂડ પ્રોસેસિંગ અને ફ્રીઝિંગના સાધનો ખરીદીને ઈન્સ્ટોલ કરવાની ઘોષણા કરી. આનાથી બ્રમ્પટન પ્રદેશમાં 60 નવી નોકરીઓ સર્જવામાં, સ્થાનિક ઉત્પાદન ક્ષમતા બમણી કરવામાં અને ભાવિ વિકાસ માટેનો પાયો નાખવામાં મદદ મળશે.

Maple Leaf Food (મેપલ લીફ ફૂડ) દ્વારા પણ 2021 માં બ્રમ્પટનમાં નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે, જેમાં નવી લાઈન અને સાધનો માટે \$80 મિલિયનનું રોકાણ, અને તેઓએ ક્લાક પર 140 અને પગાર પર 54 નોકરીઓ ઉમેરી છે.

બ્રમ્પટનના ફૂડ અને બેવરેજ સેક્ટર પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.investbrampton.ca.

અવતરણો (ક્વોટ્સ):

“સીટી ઓફ બ્રમ્પટન સતત ત્રીજા વર્ષે ફૂડ પ્રોસેસિંગ લીડર તરીકે બિઝનેસ ફેસિલિટીસ મેગેઝિન પાસેથી પ્રથમ સ્થાનનું ક્રમાંકન મેળવવામાં ગૌરવ અનુભવે છે. આ ક્રમાંકન આપણાં ખોરાક અને પીણા પ્રક્રિયાકરણના ધંધાઓ દ્વારા કરાતા ઉત્કૃષ્ટ કામને વખાણનાર, અને તેઓને

સહાયતા કરતી આપણી આર્થિક વિકાસ ટૂકડી માટે પણ પ્રમાણપત્ર મળવા બરાબર છે. પોતાની ઉદ્યોગ-અગ્રણી ટેકનોલોજી, ટોચના ગુણવત્તાના ઉત્પાદો અને સમૃદ્ધ ખેતીલક્ષી પરંપરા સાથે, બ્રેમ્પટન ફૂડ અને બેવેરેજ ક્ષેત્રમાં ખરેખર ઉદ્યોગ અગ્રણી છે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બિઝનેસ ફેસિલિટીસ મેગેઝિનના વાર્ષિક મેટ્રો રેંકિંગ્સ રિપોર્ટમાં સતત ત્રીજા વર્ષ માટે ફૂડ પ્રોસેસિંગ લીડર્સ શ્રેણીમાં #1 તરીકે ઓળખ મળવી એ આપણી સમર્પિત આર્થિક વિકાસ ટૂકડી તેમજ બધાં ઔદ્યોગિક ધંધાઓ અને તેઓના કામદારો માટે પ્રમાણપત્ર મળવા બરાબર છે. ફૂડ અને બેવેરેજ સેક્ટરમાં આપણાં અદ્ભૂત હયાત ધંધાઓને સહાયરૂપ બનવાની સાથે સાથે, ધંધો જાળવી રાખીને વિસ્તારવા પર ધ્યાન આપીને, સીટી નવા ધંધાઓને બ્રેમ્પટનમાં લાવવા માટે કામ કરી રહ્યું છે.”

- માર્ટિન મેડેરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; પ્રમુખ, આર્થિક વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટનમાં આપણી ટીમ આપણાંથી શક્ય દરેક રીતે આપણાં ધંધાકીય સમુદાયને – આપણાં સમુદાયની કરોડરજીતને – ટેકો આપવા સમર્પિત છે. આપણું ફૂડ અને બેવેરેજ સેક્ટર – અને આપણી સમર્પિત આર્થિક વિકાસ ટૂકડી – દ્વારા કરાતા પ્રયત્નોને સતત ત્રીજા વર્ષ માટે બિઝનેસ ફેસિલિટીસ મેગેઝિન પાસેથી #1 ક્રમાંકન સાથે ઓળખ મળવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ.”

- પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના મુખ્ય વહીવટી અધિકારી (ઇન્ટરીમ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર), સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca